

RAN-2108002201070013
F.Y.B.Com. (External) Examination March - 2026
Financial - Management - I (Paper - II)
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.

Seat No.:

Student's Signature

- પ્ર. 1. ટૂંકા પ્રશ્નો :** 20
1. નાણાંકીય સંચાલન એટલે શું?
 2. મૂડી માળખાની વ્યાખ્યા આપો.
 3. મૂડી પડતર એટલે શું?
 4. નાણાંકીય લિવરેજનો ખ્યાલ સમજાવો.
 5. સંયુક્ત લિવરેજના ફાયદા જણાવો.
 6. કાર્યશીલ મૂડીની વ્યાખ્યા આપો.
 7. સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચે શું તફાવત છે?
 8. ચોખ્ખા વર્તમાન મૂલ્યનો અર્થ આપો.
 9. નાણાંકીય આયોજનનો અર્થ શું છે?
 10. નાણાંકીય બજારના મુખ્ય ઘટકો શું છે?
- પ્ર. 2. ધંધામાં નાણાંકીય આયોજનને અસર કરતા પરિબળો સમજાવો.** 16
- અથવા**
- પ્ર. 2.(અ)** ઇક્વિટી શેરના ફાયદા અને ગેરફાયદા ચર્ચો. 08
- (બ)** નાણાંકીય લિવરેજ અને કામગીરી લિવરેજ વચ્ચેનો તફાવત સમજાવો. 08
- પ્ર. 3. ડિવિડન્ડ પોલિસી માટેનું ગોર્ડન મોડેલ સમજાવો.** 16
- અથવા**
- પ્ર. 3.(અ)** એકાઉન્ટીંગ રેટ ઓફ રિટર્ન (ARR) પદ્ધતિ સમજાવો. 08
- (બ)** નફાકારકતા આંકનો ખ્યાલ અને તેનું મહત્વ સમજાવો. 08
- પ્ર. 4. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો.** 16
- અથવા**
- પ્ર. 4.(અ)** મૂડી માળખામાં નાણાંકીય લીવરેજનું મહત્વ સમજાવો. 08
- (બ)** ડિબેન્ચરના લાભો સમજાવો. 08
- પ્ર. 5. ડિવિડન્ડ નીતિના ઉદાહરણ સહિત વિવિધ સિદ્ધાંતો પર ચર્ચા કરો.** 16
- અથવા**
- પ્ર. 5.(અ)** ડિવિડન્ડ નીતિના મુદ્દા વિશે સમજાવો. 08
- (બ)** સ્થિરતા ડિવિડન્ડ નીતિમાં કેવી રીતે અસર કરે છે? 08

- પ્ર. 6.(અ) નીચેના પૈકી કોઈ એક પર ટૂંક નોંધ લખો. 08
1. કાર્યશીલ મુડીના ઘટકો
 2. નાણાંકીય બજારના પ્રકારો
- પ્ર. 6.(બ) કેસ સ્ટડી : આપેલ માહિતીના આધારે નાણાંકીય અને કામગીરી લીવરેજની ગણતરી કરો. 08
- PQR Ltd. ની નીચેની નાણાંકીય વિગતો છે.
- વેચાણ આવક : રૂ. 15,00,000
 - ચલિત ખર્ચ : રૂ. 6,00,000
 - સ્થિર ખર્ચ : રૂ. 3,00,000
 - દેવા પર વ્યાજ : રૂ. 90,000
 - ઇક્વિટી મૂડી : રૂ. 8,00,000
 - દેવા મૂડી : રૂ. 5,00,000
- ગણતરી કરો :
1. કામગીરી લીવરેજ
 2. નાણાંકીય લીવરેજ
 3. સંયુક્ત લીવરેજ

ENGLISH VERSION

- Q. 1 Answer In Brief** 20
1. What is meant by financial management?
 2. Define capital structure?
 3. What is meant by cost of capital?
 4. Explain the concept of financial leverage.
 5. What are the advantages Combined leverage?
 6. Define working capital
 7. Explain the difference between fixed capital and working capital.
 8. Give the meaning of NPV?
 9. Explain the term of financial planning.
 10. What are the key components of the financial market?
- Q. 2.** Explain the effectiveness factors of financial planning. 16
- OR**
- Q. 2.(A)** Discuss the merits and demerits of equity share ? 08
- Q. 2.(B)** Explain the difference between financial leverage and operating leverage. 08
- Q. 3.** Explain Gordon's models for dividend policy. 16
- OR**
- Q. 3.(A)** Explain the Accounting Rate of Return (ARR) method. 08
- Q. 3.(B)** Discuss the concept of Profitability Index (PI) and its significance. 08
- Q. 4.** Explain the effectiveness factors of Working Capital. 16
- OR**
- Q. 4.(A)** Discuss the importance of financial leverage in capital structure decisions. 08
- Q. 4.(B)** Explain the merits of Debenture. 08
- Q. 5.** Discuss the theories of dividend policy with examples. 16
- OR**
- Q. 5.(A)** Explain the issues in Dividend Policy. 08
- Q. 5.(B)** Discuss the role of Stability in Dividend Policy. 08

Q. 6.(A) Write a short note (Any ONE)

08

- (i) Component of Working Capital
- (ii) Types of Financial Market

Q. 6.(B) Case Study: Compute Financial and Operating Leverage based on the given data.

08

PQR Ltd. has the following financial details:

Sales Revenue	: Rs.15,00,000
Variable Costs	: Rs. 6,00,000
Fixed Costs	: Rs. 3,00,000
Interest on Debt	: Rs. 90,000
Equity Capital	: Rs. 8,00,000
Debt Capital	: Rs. 5,00,000

Calculate:

1. Operating Leverage
 2. Financial Leverage
 3. Combined Leverage
-